



કોચ

શાંતિ મેચ

સ્વાગત છે આપનું "ચેમ્પિયન્સ આત્માના ફળ દ્વારા" માં! તમારો ધ્યેય છે તમારા વિદ્યાર્થીઓને ચેમ્પિયન બનવામાં સહાય કરવાનો. આમ કરવા માટે, તેઓને દૈનિક જીવનમાં આત્માના ફળને કાર્યકારી રૂપમાં મૂકવાની જરૂર છે. મોટાભાગના રવિવાર સ્કૂલના કાર્યક્રમો ચર્ચમાં હોય છે, અને અઠવાડિયા દરમિયાન હોમવર્કની જરૂર હોતી નથી. જો કે, તમારા વિદ્યાર્થીઓ તેના વિશે શીખીને તેમના જીવનના પાપોને "હરાવી" શકતા નથી. તેઓએ ખરેખર "રિંગની અંદર" આવવું પડશે અને અઠવાડિયા દરમિયાન તેઓ જે વાસ્તવિક પાપનો સામનો કરશે તેની સામે લડવું પડશે. પ્રમાણિકપણે, અને વિષે તપાસ કર્યા વિના, આ કરવું લગભગ અશક્ય બનશે. કૃપા કરીને "તેમના શબ્દ પર વિશ્વાસ કરશો નહીં" અને સ્વીકારી ના લેશો જ્યારે વિદ્યાર્થીઓ કહે કે તેઓએ એસાઇનમેન્ટ કરી લીધું છે. જો તમે આ પ્રોગ્રામ વિશે ઢીલા પડશો, તો તમે તમારા વિદ્યાર્થીઓને તમને જૂઠું બોલવા માટે તાલીમ આપી શકશો. જો કે, મારી સાથે કલ્પના કરો કે જો તમે ખરેખર તમારા વિદ્યાર્થીઓને કોચિંગ આપી શકો છો, અને ટ્રેક કરી શકો કે તેઓ હોમવર્ક કરી રહ્યા છે, તો તમે તેમના જીવનમાં વાસ્તવિક પરિવર્તન જોશો. ફક્ત એક જ વર્ષમાં, તમે તેમની જીંદગીમાં પરિવર્તન લાવી શકો છો! તમારા વિદ્યાર્થીઓ આત્માના ફળને યાદ રાખશે નહીં, પરંતુ વાસ્તવમાં તેને જીવવાનું શીખશે!

તમારી જવાબદારીઓ:

- 3-5 બાળકોને કોચિંગ આપે

- વિધાર્થીઓ સાથે એસાઇનમેન્ટની ચર્ચા કરવા માટે અને ચેમ્પિયન્સ બનવા માટે પ્રોત્સાહિત કરવા માટે દર અઠવાડિયે ક્લાસ પહેલા અને પછી 5 મિનિટ માટે વિધાર્થીઓને મળો.
- એસાઇનમેન્ટની યાદ અપાવવા માટે દર અઠવાડિયે વિધાર્થીઓને કોલ/ટેક્સ્ટ દ્વારા સૂચિત કરો. (સૂચિત = મંગળવાર)
- પૂર્ણ થયેલ એસાઇનમેન્ટનો રિપોર્ટ મેળવવા માટે અઠવાડિયે બીજી વાર વિધાર્થીઓને કોલ/ટેક્સ્ટ દ્વારા સૂચિત કરો. (સૂચિત = શુક્રવાર)
- નાના જૂથના બાળકો માટે કરવામાં આવેલ એસાઇનમેન્ટનો ટ્રેક રાખો અને હેડ કોચની દર અઠવાડિયે જાણ કરો.

પુરસ્કારો:

કોચ બનવાનો મહત્વપૂર્ણ ભાગ એ છે કે તમારા વિધાર્થીઓને વિજેતાઓ જેવો હેષા આપવો. આનો અર્થ એ છે કે તમે જે વર્તનની અપેક્ષા રાખી રહ્યા છો તેને તમારે વ્યાખ્યાયિત કરવાની અને તે વર્તનને પુરસ્કાર આપવાની જરૂર છે.

નાના-નાના સામાહિક પુરસ્કારો:

- હગ (આલિંગન)
- હાઇ-ફાઇવ્સ
- તેમના શર્ટ પર સ્ટીકર
- હાથ પર સ્ટેમ્પ
- નાની કેન્ડી

મહિનાના અંતે મોટા પુરસ્કારો:

- બાળકોને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો આપવાના પુરસ્કાર સમારોહ. (3 અઠવાડિયાના એસાઇનમેન્ટ માટે કાંસ્ય, 4 અઠવાડિયા માટે રજત, અને 5 અઠવાડિયા માટે સુવર્ણ ચંદ્રક. વૈકલ્પિક રીતે, તમે 2 પંચ માટે કાંસ્ય, 3 પંચ માટે રજત અને અઠવાડિયામાં 4 પંચ માટે સુવર્ણ પણ આપી શકો છો.)
- તમારા ઘરે એક પાર્ટી
- પ્રમાણપત્રો
- ચર્ચમાં પુખ્ત લોકોની સામે ચર્ચમાં કંઈક મોટું આપવું
- ટ્રોફી

તમારા વિધાર્થીઓને આત્માના ફળમાં કોચિંગ કરવાના પડકારમાં આપણા ઈશ્વર તમને પ્રેરણા આપે એવી શુભેચ્છા!



મેચ 10


10. શાંતિ vs. ડર

એલિજાહને જંગલી કાગડા દ્વારા ખવડાવવામાં આવ્યું

(1 કિંગ્સ 17:1-6)

સ્મૃતિ શ્લોક: માથ્થી 6:33

"પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે."



રિંગની અંદર

તમારી પાસે છે તે કોઈ અન્ય સાથે શેર કરો, એનો અર્થ એ છે કે ભલે તમારે તેના વગર રહેવું પડે. કાં તો ખોરાક, કપડાં, બસ ભાડું, અથવા કંઈક બીજું જે તમને પૈસા ખર્ચ કરાવે છે. તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે ભગવાનને કહો.



મેચ 11

11. શાંતિ વિ. ડર

પીટર પાણી પર ચાલે

(મેથ્યુ 14:22-33)

સ્મૃતિ શ્લોક: માથ્થી 17:20-21

"ત્યારે તેમણે તેઓને કહ્યું "તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચીત કહું છું કે, તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા, ' ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહિ. [21પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.] "



રિંગની અંદર

એવી વસ્તુ પસંદ કરો કે જે કરવું અશક્ય લાગે, અને તમારો ભય બાજુમાં મૂકી દો. જીસસને મદદ કરવા માટે કહો. પછી તેમાં પગલાં લેવાનું શરૂ કરો. (ચાલુ કરવા માટે એ જીત છે, જો તમે પીટર ની જેમ ડૂબી જાવ, તો પણ. ટાસ્ક એ છે કે કંઈક એવું પસંદ કરો કે જે અશક્ય લાગે અને પ્રયત્ન કરો.)



મેચ 12

12. શાંતિ વિ. મતભેદ

અન્ય ગાલ આપો

(મેથ્યુ 5:38-42)

સ્મૃતિ શ્લોક: રોમનોને પત્ર 12:18

"જો બની શકે, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને ચાલો."



રિંગની અંદર

આ અઠવાડિયે એકવાર તમારી જાતને નકારવા દો. (તે મોટાભાગે તેના પોતાના પર થશે.) તમારૂં એસાઈન્મેન્ટ કંઈ ન કરવાનું છે.



મેચ 13

13. શાંતિ વિ. સ્વયં-વિશ્વાસ

ઇસુ 5000 ફીડ્સ

(લુક 9: 10-17)

સ્મૃતિ શ્લોક: કરિંથીઓને બીજો પત્ર 12:9

"અને તેમણે મને કહ્યું છે, 'તારે માટે મારી કૃપા બસ છે; કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.' ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ માટે ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ."



રિંગની અંદર

ભગવાનને એવી જગ્યા માટે પ્રાર્થના કરો કે જ્યાં તમે નબળા છો. તે વિસ્તારના ચર્યમાં સેવા આપવા માટે સાઇન અપ કરો. જો તમે શાંત છો, તો આ અઠવાડિયે વધુ બોલો. જો તમે વધુ બોલતા હોય, તો આ અઠવાડિયે શાંત રહો.

વિદ્યાર્થીઓ _____

1. _____

2. _____

મેયો

10 11 12 13

				પ્રહાર
				કોસ
				હૂક
				અપરકટ

મેયો

10 11 12 13

				પ્રહાર
				કોસ
				હૂક
				અપરકટ

3. _____

4. _____

મેયો

10 11 12 13

				પ્રહાર
				કોસ
				હૂક
				અપરકટ

મેયો

10 11 12 13

				પ્રહાર
				કોસ
				હૂક
				અપરકટ

5. _____

6. _____

મેયો

10 11 12 13

				પ્રહાર
				કોસ
				હૂક
				અપરકટ

મેયો

10 11 12 13

				પ્રહાર
				કોસ
				હૂક
				અપરકટ